

તંત્રીલેખ

ચુંબક કુકો

૨૦૧૪માં જ્યારથી ભાજપની કન્દુ સરકાર દેશ પર રાજી રહી રહી છે ત્યારથી તેના ખાસ મિશન રાણા પગલાંથોથે દેશના મુખ્યમાંથી અવિશ્વાસ અને ચિંતાનું વાતાવરણ સતત વધી રહ્યું હૈએ. હિંદુત્વાદી એજન્ડા પર કામ કરી રહેલી મોટી સરકાર હેઠળની કટ્યાળની કામગીરી આંગી પણ મુખ્યમાંના મુખ્યમાં હુંસું રહ્યું રહી છે કે જેથી હિંદુ-મુસ્લિમલાનાં કરીન તેના જીવાદોરી (લાર્ડ લાર્ટન) ને સતત જીવત રાખી શકાય. એટેબદિન જેનાથી સોઠેન તકલિફ ન થેયે તેવા મુખ્યમાંના મુદ્દામાં તે રાણ ચુંચપાત કરી રહી છે. પછી તે નાશ તલબકરો મુદ્દા થોય કે એદેસાના શિક્ષણનો મુદ્દો હોય કે હાલ ઉત્ત્વાદી રહેલો વક્ફનો મુદ્દો હોય.

देशना भोटा भागना मुस्लिमोंचे क्यारेय वर्तमान भाष्यप्रसरकार पासे त्रांग तवाक मुहूर्ह केंद्रसाठी कामगिरीची बाबते केंद्रकांनी संपर्काचा बाबते काई संशोधनाची अभियांत्रिकी करी नवीची
जेथी सरकारने आपली बाबतोमांद दृष्ट देवी पडे... बळे आपलीकरणाचे कामकाज संभालावा उंचानोनी MSP-नी मांगा, बोरोजापूर युवांनांनी
तारा रोजगारीनी मांग पडी अनिवारी जेवी योजनानो
वरेख, शिक्षकोनी मांगणीलो, पैपरलीक जेवा विद्यार्थ्यांना
युद्धाचे, असत्य मोंवावारी वर्गाते जेवा संख्यावंश प्रश्नोंनंते
मानांदिलानो चाली रक्खा छ अने भोटाभाजे ते देशनी बहुमती

ମେବୀ ୮୫ ଟଙ୍କା ଵର୍ତ୍ତି ଛିଦ୍ରାଜୋନା ପ୍ରଶ୍ନୋ ଛେ ଧାରା ଆ ହିଂକୁତ୍ୟାତୀ ରେକାର ତେନା ତରକ ଧ୍ୟାନ ଆପବାନେ ବଦଳେ ଜେଣା ମାଟେ ଶେରୀ ମାନ୍ଦିଲାନୋ ନଥୀ ଥ୍ୟା ଜେଣା ମାଟେ ଶେରୀ ରାଜ୍ୟିକ୍ ସର୍ତ୍ତେ ମାଣ୍ ନଥୀ ଏହି ଅର୍ଥ ବୁଝିଲେବାନେ ମୁଖ୍ୟାନେ କୁମାରାଜେନ୍ ଧାର୍ ଉପର ଲଈ ମୁଖ୍ୟାନେ ଏହି ଏହା ମୁଖ୍ୟିବେଳେ ମୁଖ୍ୟାନେ କୁମାରାଜେନ୍ ଧାର୍ ରାହି ଛେ କେ ତେ ମୁଖ୍ୟାନେ ଏହି ଏହା ଏମାନ୍ ପାଇଁ ତୋଣ ତେ ଏବେ କରୀ ରାହି ଛେ ପାଇଁ ଯେ ପଗଳାନେ ମୁଖ୍ୟିବେଳେ ହିତ ଆବୁ କରି ରାହି ଛେ ପାଇଁ ଯେ ପଗଳାନେ ମୁଖ୍ୟିବେଳେ ବିରୋଧ କରି ରଥ୍ୟ ଥ୍ୟା ଥ୍ୟା ତେନେ ତେ ଅଭ୍ୟାସମାନୀ ଲାଗୁ ହେବାକୁ ଛି ଏହି କିମ୍ବା ଭାଷାର ରେକାରନୀ ଆ ଧାର୍ ପ୍ରକାରନୀ ମୁଖ୍ୟାଜୀବୀ ପାଇଛନ୍ତି କେବେଳା କେସରୀ ରଙ୍ଗନା ଯକାମାନେ ସହିଷ୍ଣେ ସମଜ ଶକ୍ତ୍ୟ ଏମି ଛେ କେ ତେ ରେକାର ଗରୀବ ମୁଖ୍ୟମୋନେ ସ୍ତୋରଶିପିନା ସ୍ଵରୂପମାନ ମଣି ଏହେଲୀ ଶାପ ନଜ୍ଞାବୀ ସହାୟନେ ପଶ ସାହନ କରି ଶକ୍ତି ନଥୀ ଏନେ

વક્ફ સંશોધન બિલ પર બ્રેક : સરકાર ભારતીય મુસ્લિમોનો સંતાપ સમજે

ਫੇਂ ਮੁਖਿਲਮੋਨ੍ਹ ਦਿਤ ਕਿ ਰੀਤੇ ਲੋਈ ਥਕੇ ? ਮੁਖਿਲਮੋਨਾ ਸ਼ਾਰੇ ਆਮ ਵਿਖੇਗੇ ਜੇ ਸੁਰਕਾਰ ਅਟਕਾਵਤੀ ਨ ਹੋਵੇ, ਮੁਖਿਲਮੋਂ ਵਿਦੁਨ ਨਕਰੀ ਯੁਗਾਂਮਾਂ ਸਾਮੇਲ ਲੋਕਿਨ੍ਹ ਸੰਭਾਨ ਕਰਤੀ ਹੋਵੇ ਅਮੇਰੀਕਾ ਸਾਂਸਥ, ਧਾਰਾਸਤ੍ਵ ਕੇ ਮੰਨੀ ਬਨਾਵਤੀ ਹੋਵੇ ਅਮੇਨਾ ਨੇਤਾਓਂ ਸਮਝਕੀਨੇ ਮੁਖਿਲਮੋਂ ਹਾਮੀ ਲੋਈ ਥਕੇ ਪੜੀ ਹੋਵੇ ਅਤੇ ਸਰਕਾਰ ਮੁਖਿਲਮੋਣੀ ਲਾਮੀ ਲੋਈ ਥਕੇ ਪੜੀ ? ਉਲ੍ਟਾਂ ਅੰਦੀ ਗੇਰਸਮਜ਼ ਕੇ ਲਾਵਾਹਿਣੀ ਰਹੀ ਛੇ ਕੇ ਜੇਥੀ ਫੇਰਾਂ ਬਹੁਮਤੀ ਸਮਾਜ ਵਿਦੇਸ਼ ਮੁਖਿਲਮੋਨੇ ਬੁਨਤਾਂ ਲਾਗੇ...
ਮੌਹਿ-3.੦੯ਆਂ ਕਾਰਵਾਂ ਲਈ ਭਾਜਪਾਨਾ ਨੇਤ੍ਰਵਾਲਾਂ ਤੇ
ਸੁਰਕਾਰ ਵਕਕ ਸੱਥੀਥਾਂ ਬਿਲ ਲਈ ਆਵੀ ਛੇ। ਆ ਵਕਕ ਸੱਥੀਥਾਂ
ਵਿਖੇਧਕੀ ਨ ਤੋਂ ਫੇਰਨਾ ਮੁਖਿਲਮੋਏ ਮਾਂਗ ਕਰੀ ਹਨ ਕੇ ਨ ਤੋਂ ਅ
ਕੋਈ ਸਾਰਵਜਨਿਕ ਦਿਤਨੀ ਬਾਬਤ ਹਿੱਤੀ... ਵਾਸਤਵਮਾਂ ਫੇਰਨਾ ਮੋਟਾ
ਭਾਗਨਾ ਮੁਖਿਲਮੋਨੀ ਲਾਲਤ ਗ੍ਰੰਥੀ ਕੇ ਕੜੀ ਛੇ। ਫੇਰਨਾ ਸੀਥੀ
ਪਛਾਤ ਵਾਹੀ ਕਰਤਾ ਪਥ ਮੁਖਿਲਮੋਣੀ ਇਥਿਤ ਪਛਾਤ ਲੈ ਲਾਵੇ ਤੇਨ
ਭਵਾਵ ਅਨੇ ਉਤਤ੍ਰ ਮਾਟੇ ਮੁਖਿਲਮ ਸਮਾਜਾਂ ਜੇ ਲੋਕਾਂ ਪੋਤਾਨ
ਸੰਪਤਿਆਂ ਕੀ ਕਲਾਗ ਮਾਟੇ 'ਵਕਕ' ਸ਼ਵਰੂਪ ਫਾਨਮਾਂ ਆਪੀ ਦ
ਤੇ ਸੰਪਤਿਆਂ ਵਾਲਾ ਨਫਰਤੀ ਵਿਚਾਰਾਂਥਾਨਾ ਲੋਕਾਂ ਪੇਟਾਨ
ਥੁੱਕ ਆਵੇ ਛੇ ਕੇ ਮੁਖਿਲਮੋਨਾ ਦਿਤ ਮਾਟੇ ਆਟੀ ਬਖੀ ਸੰਪਤਿਆਂ
ਮਿਕਲਤਾ ਕੇਮ ? ਅੰਤ ਤਮਚੀ ਪੋਤਾਨਾ ਸੁਰਕਾਰਾਂ ਰੇਖਾ ਆਕਾਸਾਂ
ਕਹੁੰ ਕੇ ਵਕਕਾਨੁੰ 'ਕਿਈ' ਕਰੀ ਅਨੇ ਸੁਰਕਾਰੇ ਕੀ ਪਥ ਨਾਲ੍ਹੁੰ... ਮੌਹਿ
ਸੁਰਕਾਰ ਵਕਕ ਸੱਥੀਥਾਂ ਵਿਖੇਧ ਲਈ ਆਵੀ.... ਕੇਵਿਨੇਟੇ ਪਥ ਅੰਨੇ
ਮੈਂਜੂਰੀ ਆਪੀ ਵੀਧੀ ਅਨੇ ਸਾਂਦਰਾਂ ਰ੍ਹੂ ਪਥ ਕੁੰਜੀ ਅਤੇ ਬਲ੍ਲੁ ਵੱਖ
ਪਾਰਾ ਫੇਰਨਾ ਸਮਜੂ ਪ੍ਰਯਾਨ੍ਤ ਜੇਕੇ ਆ ਗੀਤੀ ਵਪਤ ਮੌਹਿ ਸੁਰਕਾਰੇ
ਸੰਪੂਰਾ ਭਡੀਮਤ ਨ ਆਪੀ ਨਹੀਂ ਰਹ ਅਗਾਊਂ ਨੇ ਸੁਰਕਾਰੇ ਦਰਸ਼ਾਵ
ਕੇ ਰੀਤੇ ਤੇ ਅੰਤਰਕੀ ਅਨੇ ਏਕਲਾਵੀ ਵਿਖੇਖੀ ਪ੍ਰਾਤ ਕਰੀ ਕਿਧਾ ਸਾਂਦਰਾਂ
ਵਖਤੁੰ ਆਪਾਤੀ ਹਿੱਤੀ ਤੇ ਆ ਵਪਤੇ ਗੀਤੀ ਟਰਮਾਂ ਥਕ ਜਾਣਾ
ਨਥੀ.. ਬੀਜੁੰਟੇਕਾਨੀ ਟੰਬਘੋਵੀਆਂ ਪਰ ਸਾਵਰ ਵਰਤਮਾਨ ਕੰਨ੍ਹ ਸੁਰਕਾਰੇ
ਅਗਾਊਂ ਜੇਮ ਵਿਪਕਨੀ ਪਥ ਅਵਗਣਾਨ ਕਰੀ ਥਕੇ ਅਮ ਨਥੀ
ਕਾਰਾਥ ਕੇ ਆ ਵਪਤੇ ਵਿਪਕ ਪਥ ਮਜ਼ਬੂਤ ਛੇ ਏਟਵੇ ਏਣੇ ਵਕਕ
ਸੱਥੀਥਾਂ ਬਿਲਨਾਂ ਭਰਪੁਰ ਵਿਚੇਖ ਕੰਧੀ ਜੈਨੁ ਪਰਿਵਾਸ ਦੇ ਆਵੁੰ
ਮੌਹਿ ਸੁਰਕਾਰੇ ੧੧ ਵਰ੍਷ਾਂ ਪ੍ਰਥਮ ਵਪਤ ਪਿੰਡਿਛ ਕਰੀ ਪੀ ਅ
ਵਕਕ ਸੱਥੀਥਾਂ ਵਿਖੇਖ ਅੰਗੇ ਸੰਭੁਕਤ ਸੰਸਾਈ ਸਹਿਤ (ਐਪੋਸਿ) ਨ

मिथांबुक करवी पड़ी... जो के आ जैपीसीनी ब्रेक मोटो सरकार
इसे सुधी क्षाखामां रायपंथे ऐते तो आवापारो समय ज ज्ञापा
परंतु आ वक्फ क्रायपालां जे सुधारानी ज्ञेगवाई कराई छे
केटली भयंकर पक्षपाती अने अन्यायी छे तेनो अंदाजो ऐ
परथी आवी शेंडे के मुखिलमोना सो टका धार्मिक एवा 'वक्फ
बोर्डिना संचालनमा बिन मुखिलम सरप्तोने लाववानी वात छे।
देशना पवित्र बंधारणे मरती क्लब रप अंतरित देशना दा
नागरिकोंने पोतानी मरती क्लब मुख्तजनो धर्म पाणावानी वात
आपी छे। एतेवु ज नहीं पापा क्लब रप हेठा देके धर्म
अनुयायीओने तेमनी मिथकता-संपत्तिआनु व्यवस्थापन
(मनजभन्न) क्रवानी पापा अगाधी आपी छे त्यारे वक्फ बोर्ड
बिन मुखिलमोने समावानी वात कर्ती रीते व्याजी गाथाप
आ तो अंतु थुकु के क्लानात्त दे अयोध्यामां रामामंटिरना ट्रस्ट
बाह्य कोइ पापा पवित्र हिंदु स्थानना वहीवटमा मुखिलम संचाल
लेवानी ज्ञेगवाई कराये... मुखिलमी वात तो ज्वा हो पापा
कोइ पापा हिंदु पवित्र स्थानाना वहीवटमा इस्ती, शीर के पास
के पहुँचीने स्थान आपावानी ज्ञेगवाई मोटी सरकार के
उक्के मुखिलम संचित कोइपापा बिन हिंदुहो आवी पापाविठो
मार्ग पापा करी नस्थी परंतु संपूर्ण मुखिलम धार्मिक संस्था
वहीवटमा बिन मुखिलमोन धृसाइवानी ममत केन्द्र सरकार दे
करी रही छे ? तेनो पाछावानी मंथा सहेजे समाज शक्य ए
छे... वर्णी अबहु ज नहीं पापा मुखिलमो संपत्ति-मिथकत अ
निजायो लेवानी वक्फ बोर्डीनी सत्ता पापा ते छीनवाली लेवा
मार्ग छे... वासत्वमां वक्फ बोर्ड वक्फानी एक तात्परता मातिर
नस्थी... तो सो टका मुखिलमोनी ऐवी आ तमाम संपत्तिओ
संचालनानु निरिक्षण (मोनिटरिंग) करवा माटोनी एक स्वीक
व्यवस्था छे। वासत्वमां देशभरामां पथरायेली आ वक्फ मिथक
मात्र अने मात्र जे ते विस्तारना मुखिलमोना संचालन हेतु
छे नहीं के वक्फ बोर्डीना... वक्फ बोर्ड के काउन्सिल तो अं
सुचारू वहीवट माटोनी व्यवस्था छे... त्यारे ऊद केन्द्र सरकार
मुखिलमोना बंधारणा अविकारी पर तराप मारे तो अं देश
क्लब १४ हेठा आपेला समानताना अविकारोनु पापा उल्लंघ

કહેવાય કે નહીં ?
વાતવરમાં તો ખુદ સરકાર બંધારણની ભાવના વિરુદ્ધ જ
રહી હોવાનો અદેશાસ માત્ર દેશના મુખ્યમંત્રોને જ નહીં પ
મોટા ભાગના બિનભાજીપી રાજકીય પકો અને તેમના લિ
સમયદ્રોપે પણ થઈ રહ્યો છે. તેમને લાગે છે કે સરકાર ર
રીતે સમવાયી તરની વિરુદ્ધ, ધાર્મિક લઘુમતી વિરુદ્ધ જ ન
પણ માનતાવની પણ વિરુદ્ધ જઈ રહ્યી છે કારણ કે જે લો
મુખ્યમંત્રીમાંના માનતા નથી તે લોકો તેના વહીવર્તમાં કાઈ રે
દખલ કરી શકે ?
બીજો એક દુષ્યચાર એવો પણ કરવામાં આવી રહ્યો છે
મોગળોએ એટલે કે મુખ્યમંત્રીની બાળજન્માર્થી સંપા
પર કબજો કર્યો હતો. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મોગળો
દેશને અમુલ્ય ધરોડો આપી છે કેમ કે તાજમહેલ, લાલિકલ્લ
કુતુખમિનાર વગેરે વગેરે કે સરકારની માલવિકી ડેઢણ
બાકી ટીપુ સુલ્તાની માંનીને મોગળ શારક બાદદુરશાહ જ
સહિતના મુખ્યમંત્રીને તો અંગ્રેજોના વિરુદ્ધ આગ્રાની
જંગનો પાયો નાખ્યો હતો અને દેશની આગારોની આ જંગ
જ એમણે પોતાના માણથી માંનીને સર્વર્ષ ગુમાવી દીધું... જા
તમે જુઓ કે અખાડ ભરતના માલવિક હોવા છુંાં માણવોની
વંશજી પાસે દેશની તસુમાર પણ સંપત્તિ છે બરી ? તે તો આ
ક્યાં અને કેવી દારુણ હાલતમાં છે એની પણ બખર નથી... એ
બદલે તમે જુઓ કે જેઓ ક્રિયા રાજમાં અંગ્રેજો સમકા ઝડપે
કા તે રાજ્યાંત્રોના વંશજી પાસે આજે પણ અણકા મિલકો
જેમાં જ્વાલિયારના સિંધ્યાધાર, મૈસુરુના પુટાયોરા કે ઉદયપુરના
ઉદય માનસિંહ કે વડોદરાના ગાયકવાડાના વંશજી પાસે આ
સંપત્તિ છે. કંઈક આવી જ રીતે લખાનો, ડેંડરાખા, આર્કો
ખંભતાના નવાબોના વંશજી પાસે રહેલો મિલકો છે. ટૂંકાંના
અંગ્રેજોના કલ્યાંગરા હતા એમની પાસે અણકા મિલકો ર
કે જેને આજે પણ તેમના વંશજી ભોગી રવા છે બાકી અંગ્રે
સામે લેલા ટીપુ સુલ્તાન કે મોગળ બાદદુરણા વંશજી પા
આજે કશું જ નથી કેમ કે તેમના પ્રવર્તનોએ દેશ માટે અંગ્રેજો સ
લિધેને પોતાનું સર્વર્ષ ગુમાવી દીધું.

દમાં ચિંતાજનક વળાકની ટકોર કુમ

**નવા કાયદાનો પ્રચલિત
નિકટવર્તી મનોભાવ,
ગુંયવણ અને
અસ્વસ્થતા પેદા કરે છે**

કેરકારો લાખે છે, જે વુધ તુકસાનાકર છે

અનિષ્ટ અને તાજા શીજદારી કોસોમાં લાગુ
નવા કાયદા અંગે સ્પષ્ટતા

૧ જુલાઈ ૨૦૨૩થી, પોલોસ, નાયા માયમ
અને આદાલતોમાં બેચે શીજદારી યુનાનો-તાપસ
અને નિયમાનો વાચાનાના અવારોધો સમયોનું કરવું
પડેશ. યુનોનું આચરણ, તેની નોંધકારીનો સમયગાળાનો
અને કોઈ સંસ્કરણ તેની રહુતાતાના આધીં, આવા
દેણો નકલી કરવા માટે જ્ઞાન અને નવા શીજદારી
કાયદાની અને આવા સંયોજન લાગુ પડે. આ
પૃથ્વીકરણ અનિષ્ટ તેસે પાટે પણ સંસ્કરણ રહેશે,
અને પણ કરીને અગ્રણી CRPC અને નવા
જૂ કરાયેલ BNSN ડેટા પ્લાનવામાં એવેલ
પ્રકારાત્મક સુરક્ષાના સંબંધિનો પોત્યાપણાં એ કે,
તે આશ્વયજનક નથી કે આવા વિશેષા શીજદારી
ન્યાય પ્રશાલા કરી કેવી રીત કોઈ સુધીનું કરી રહ્ય
છે એવલેખે પેન-ન્યૂની અને તાજા તેસે સાચે સીમ
પર છલકાઈ રહે છે. વાચાના, તે માય સ્પુષ્ટિત
યુનાનોની ગુંયવણમાં વધારાનું સરત માદાન કરીને
યુનાનોની ગુંયવણ અને આવાસાનોની વધારા કરે
છે. તાજેખાના પણેલાં અને લાયાચા હાલાઈકોન્ટ
એક નિર્ધિંજા દ્વારા આ બાબત સંચ થઈ છે. જ્ઞાન
અગ્રણી CRPCના ૪૮૨ની કલમ દેણા
શીજદારી કાયદાનીનું રદ કરવાની અનુભાગે કાગવી
દીની હતી. BNSN અને આવાસાનોની આધી તોને
ઉપયોગ કરવાનાં આયો હતો અને તેથી અરજ
કરવાનાં આયો હતો અને તેથી અરજ
BNSS ની કલમ
ઝાંખી. જ્યારે નવા
શીજદારી પ્રાણ
લાવેશે કે તેમ પૂર્વ
તેથાં નથી. તેણોને
બિનકર્યાત્મનાનો ન
અગ્રણી જ્ઞાનવાઈ
કરવાના આયો હતો
તેને ફિનિકલ આપ
રહેશે અથવા નવા કા
પણે. જે ફિનિક હેઠળ
અર્થપૂર્વી પ્રકાર
સંસ્કરણનો ખર્ચ કર
અધ્યોગ જગ્યા
વિરોધનું મુશ્કે
શીજદારી કાયદાનીનું
કરવાનું છે. સામાયિ
વિચારણા શરીમાં હં
કાયદાનો પરદામાં
ડુરાંપણો વિશે આદા
લાલ દયામાં અવી
પંચાંગો કોઈ પ્રાણની
શીજદારી ચાચ પ્રાણ
કરવાનો પ્રકાર કરી વિ
ન હતી. આવી ચ
પ્રકારાદીયી ન્યાય
પણ કરીને જ્યાદા ક
મોટી લોકશાલી તરી
માનવ અધિકારો ચ
પર ફિઝાની ન્યાય
માને છે. નવા શીજદારી
સંવાદનો અભાવ, ૨
આપે છે કે, જ્યારે

અને ત્યારે તેમની રજૂઆત સરકારી ખેદીના રહેલી પ્રાથમિકતાઓની સંકેત કરવામાં આવેલા પ્રાફિન વેલાર કોઈ સાચે ન હોય જાણવાની ઉપાયમાં પરિવ્યક્તિ પણ કરું જરૂરી છે. એવા વધુ પણી ની શ્રમ સંપૂર્ણતા કરવાની પણ સમગ્રે દેવામાં વાગું કરવાની આવી રહેલી પ્રાથમિકતાની સંખ્યાબન્ધ વાગું કરવાની હજુ સુધી તેમ પોતાના અવિરાસિતીની લોભના બીજી છ. માટે અંતિમ નિર્ણયની ઘોસ્થાન બીજી કરવાની અરજીની લોભના એ હોય તો એ કંઈ બાળ બારાનું કરવાની હોય કરું જરૂરી છે. એવા વધુ ન્યાયિક સમય અને અન્યતાઓ

અરજીની એ પણ છે કે, નવા રજૂઆતની રજૂઆતના વિના એ તે ત્યારાં અને તેના બદલી આ એનોપાયકરણ અધિકારીની મોહ્યે હતા. નવા રજૂઆતની કોઈ અલ્લાદેન ચર્ચા વિચારણા એ કંઈ. સંસદ દ્વારા પ્રાયદી ગંગાનાં આવ્યો નહોય, એ મેતાની પ્રતીકારિય સંખ્યાબન્ધ વિના ચર્ચામાં આવી રહ્યો એવી બિનાની સહભાગીઓ નિર્ણયની સૌથી અરતની સ્થિતિ અની (b) વ્યક્તિગત સ્પષ્ટતાઓ વાળામાં ફેરફારોનું મહત્વ વિનાની સહભાગીઓ પર સહભાગીઓ દીલીને વધુ વિશ્વાસીની વતા નિર્દયી કાયાવાણી વતા

મહાત્મા ગાંધી સાથે જેલમાં જનારા ૧૧૪ વર્ષના સ્વતંત્રતા સેનાનીનું વર્ષ ૨૦૧૫માં કોલકાતામાં અવસાન થયું હતું

પ્રાણિત ધર્મશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની : શૈખુલ હિંદ મૌલાના મહેમુદ હસન

આમારાન જાળ રાશે રહતા. તથા વિશ્વાસની સારવાતનાં વિશેપાતા ધરાવતા હતા અને તેઓ પોતાનું કાં કર્યા પછી તેમની પરદેશાગત ચાલવાની આદત કર્યે ચુકીતા ન હતા. તેઓ સંખ્યાવાથી પીઠિત હતા જાન દરદ્દી તેઓ તેમની વિટનેસનું જાસ ઘણા

સર્વત્રાં વાય કરે છે. તેઓ કહે છે કે તેમો શાન્દાં એક બંગર હતા. રાજકારણથી લઈને ચુકીવાડ સુધી, એવી વિવિધ વિષયોની તેમની સંખ્યા ચુકી કરતાં હતા, હવે અંજેણાં તેમના જીવ લોકો માણવ મુશ્કેલ છે.

દાખલ ઉલ્લમભાણી સ્તાતક થયા પછી, તેમણે ૧૮૭૩થી ૧૮૮૦થી ચાચાયથી તરીકે તેમની નિમણૂક સુધી તે જ સંસારમાં શિકાંક રીતે રેવા આપી હતી. એ સમયાન ઉલ્લમભાણી અને દાખલ ઉલ્લમભાણી શિકાંક અને વહીવિદી ટ્રેડર્સની તેમની વસ્તુતાથી વિપરીત, તેઓ દેશની રાજકીય ઘટાનાં વિશે પણ સંપૂર્ણ માહિતગાર રહેતા હતા. ૨૦મી સદીનો બીજો દાયકો એ તુર્કી સામ્રાજ્યને ઉલ્લંઘાવી પાડ્યા માટે પદ્ધતિની સત્તાએ

અસફ અલી (૧૧ મે ૧૮૮૮ - ૨ એપ્રિલ ૧૯૫૩) એક પ્રભ્યાત ભારતીય સ્વતંત્રતા સેનાની અને જાહીતી ભારતીય વકીલ હતા. તેઓ અમેરિકામાં પ્રથમ ભારતીય રાજકુદૂ હતા. તેમણે આડિશના રાજ્યપાલ તરીકે પણ સેવા કરી અહીં હતી. અસફ અલીએ તેમનું શિક્ષણ દિલ્હીની સેન્ટ ક્રીસ્ટિયન કોલેજના પૂર્વી ક્રુસ્ટી હતું. તેમને શંગેર-જ્મા વિન્કસ ઠિન્સન્સની બારમાં બોલાવવામાં આવ્યા હતા. ૧૯૧૪ રાના, અંડોમન સામ્રાજ્ય પર કિંશાશુભ્ર ભારતીય મુખ્યમંત્રી સમૃદ્ધય પર મોતી અસફ પડી હતી. અસફ અલીએ તુર્ફી પણ તેઓ આયો અને પિલી કાઈચિલમાંથી રાજ્યાનું આયું હતું. તેમો અને અસફકરાના કૃપ્યા તરીકે જોયું અને ડિસ્પેલ રૂપાંતર ૧૯૧૪રાના ભારત પરત કર્યા હતા. ભારત પરત કર્યા પછી, અસફ અલી રાજ્યવાદી ચણવળમાં સામેલ થયા હતા. તેઓ ૧૯૩૭માં મુલિમ નેશનાવિસ પાર્ટીના સભ્ય તરીકે સેન્ટ્રલ લોજિસ્ટિક્યુનિવર્સિટી એસેન્સીલી માટે ચૂટાયા હતા. ત્યારાંથી તેઓ કોંગ્રેસના સભ્ય તરીકે નાયથ નેતા તરીકે નિયુક્ત થયા હતા. સ્વતંત્રતા ચણવળ દરમયાન અસફ અલીએ જેવાસસ ભાગથ્યો હતો. તેમાંથી છેલ્લો સમય ઓગસ્ટ ૧૯૪૨માં ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા કરવાયા અને વેલા 'ભારત છોડો' આંદોલનને પગળી હતો. તેમને જ્વાહરચલાયા નહેલાં અને કોંગ્રેસ વર્કિંગ કમીટીના સભ્યો સાથે આંદોલનનાર કોઈ જોખમાં નાખકેની ચણવળમાં આવ્યા હતા. તેઓ ૨ સપ્ટેમ્બર ૧૯૪૮થી જ્વાહરચલાયા નહેલાં નેતૃત્વ

હેઠળની ભારતની વચ્ચેગાળાની રસ્તકરામનો રેલવે અને પરિવહનનો હવાલો સંબંધાત્મક હતા. તેમણે કેશ્વરાયારી ૧૯૮૭નું મધ્ય એપ્રિલ ૧૯૮૭ સુધી ચુનાઈડ સ્ટેટ્સમાં પ્રથમ ભારતીય રાજ્યૂદ્ધ તરીકે સેવા આપી હતી. અસફ અલ્લી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ ભારતીય રાજ્યૂદ્ધ હતા. તેમની બે ટર્મ માટે ઓદિશાના ગવર્નર અને બાદમાં સ્ટેટ્યુર્ચરનું ભારતીય રાજ્યૂદ્ધ તરીકે નિમન્ખલુક કરવામાં આવી હતી. અલ્લી નવેમ્બર ૧૯૮૮પણે રાજ્જોહાણ આરોપમાં ભારતીય રાષ્ટ્રીય સૈચના અધિકારીઓના સરંસરી માટે કોંગ્રેસ દ્વારા પ્રતિ પ્રતી આવાના કંપનીનર બન્ધન. ભગતસિંહ પર ભારતીય દુંડ સહિતના કંપની મંજુર ઢેંગ હત્યાના પ્રયાસનો આરોપ મુક્કવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના સભ્ય અસફ અલ્લી તેમના વકીલ હતા. ૧૯૮૨માં, તેમણે અખ્યાન અસફ અલ્લી સાથે લંઘ ર્યાં હતા, આ લંઘ ધર્મના આપારે વિવાદસ્થભ બન્યા હતા. (અસફ અલ્લી મુસ્લિમ હતા જાયારે અનુલૂણ લિન્કુલ હતા) અને વધુ તફાવત (અખ્યાન તેમનાથી ૨૦ વર્ષ જુનિયર હતા) પણ હતો. ભારત છોટો ચ્યાપણ, ૧૯૮૨ દરમિયાન બોઝેના ગોવાલિયા ટાંકી મેદાનના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વજ્ઞ લંદેરાવું માટે તેવણી પરાપરો વાદ કરવામાં આવે હતું. અખ્યાન અસફ અલ્લીની તેમના આ કાર્ય માટે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરુષાર્થ, ભારત લંથાના કંપનીના કરવામાં આવ્યા હતા. સ્ટેટ્યુર્ચરનું ભારતના રાજ્યૂદ્ધ તરીકે ફરજ બન્યાવતા અસફ અલ્લીનું રૂ એપ્રિલ ૧૯૮૭ના રોજ બંન્ધ ખાતેના કાર્યાલયમાં અવસાન થયું હતું. ૧૯૮૮માં ઇન્ડિયા પોર્સે તેમના સર્વાનામાં સ્ટેમ્પ બહાર પાડ્યું હતું.

